

કોર્ટ ઓફ કમિશનર (વિકલાંગ વ્યક્તિઓ માટેના)

ગુજરાત રાજ્ય

(Deemed Civil Court) વિકલાંગ ધારો (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ૧૯૯૫

ભોંયતળિયે બ્લોક નં. ૧૬, જુના સચિવાલય, સેક્ટર-૧૦, ગાંધીનગર- ૩૮૨૦૧૦

કેસ નં. ૫૪૬/૨૦૧૬

ક્રમાંક કમિ/અપગ/૨૦૧૬-૧૭ /

તા. /૦૮/૨૦૧૬

વાદી:-

પટેલ વિનોદભાઈ ભીખાભાઈ,
મદદનીશ શિક્ષક,
જી.ડી.હાઇસ્કૂલ, વિસનગર,
તા. વિસનગર, જિ. મહેસાણા

વિરુદ્ધ

પ્રતિવાદી:-

- (૧) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, (માધ્યમિક શિક્ષણ)
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી,
મહેસાણા જિ. મહેસાણા
- (૨) આચાર્યશ્રી તથા સંચાલક મંડળ,
જી.ડી.હાઇસ્કૂલ વિસનગર
તા. વિસનગર જિ. મહેસાણા

વિષય:- વિકલાંગ શિક્ષકની વિકલાંગતામાં વધારો થતાં નોકરીમાં ચાલુ રાખવા અને આનુષંગિક હકકોના રક્ષણ માટેની રજૂઆત બાબત. પટેલ વિનોદકુમાર ભીખાભાઈ તેઓની તા. ૨૦/૬/૨૦૧૬ ની અરજીથી ચાલુ નોકરી દરમિયાન વધુ વિકલાંગતા પુખ્ત થતાં નોકરીમાં વિકલાંગ ધારા અન્વયે રક્ષણ આપવા રજૂઆત કરેલ હતી. શ્રી પટેલની રજૂઆત ભારતીય વિકલાંગ ધારો-૧૯૯૫ની કલમ-૪૭ (૧) અન્વયે નોંધણી કરી કેસ નં. ૫૪૬/૨૦૧૬ તરીકે દાખલ કરી તા.૧૨/૭/૨૦૧૬ ના રોજ મુદત રાખવામાં આવેલ મુદતે વાદીશ્રી પટેલ વિનોદકુમાર ભીખાભાઈ હાજર રહેલ.

૨. શ્રી પટેલ વિનોદકુમાર ભીખાભાઈ સુનાવણીમાં જણાવેલ કે તેઓ વિકલાંગ અનામત બેઠક પર તાલીમી શિક્ષક તરીકે તા.૪/૩/૨૦૦૫ થી મદદનીશ શિક્ષક તરીકે જી.ડી.હાઇસ્કૂલ,

વિસનગર ખાતે માધ્યમિક વિભાગમાં ફરજો બજાવે છે. તેઓ જ્યારે નોકરીમાં દાખલ થયા ત્યારે તેમને ૫૦ ટકા અસ્થિવિષયક વિકલાંગતા હતી.

૩. જાન્યુઆરી-૨૦૧૫ માં માંદગી લાગુ પડતા જમણી બાજુના હાથપગમાં વિકલાંગતા વધેલ છે. તા.૬/૧/૨૦૧૬ના સિવિલ સર્જન, મહેસાણા પ્રમાણપત્ર મુજબ તેઓને ૭૫ ટકા વિકલાંગતા છે. તેઓ તા.૨૨/૪/૨૦૧૫ ના રોજ રજા ઉપરથી ફરજ પર હાજર થયેલ છે. શાળા અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ધ્વારા તેઓને સ્વૈચ્છિક રાજીનામુ આપી દેવા સમજાવામાં આવે છે. પરંતુ તેઓને પોતાની સારવાર અને પરિવાર તથા અન્ય જવાબદારીઓ પણ હોઈ નોકરી છોડી શકે તેમ નથી તે સંજોગોમાં તેઓને ભારતીય વિકલાંગ ધારો-૧૯૯૫ની કલમ ૪૭ (૧) (૨) ની જોગવાઈઓ અન્વયે નોકરીમાં રક્ષણ મળવું જોઈએ.

૪. જી.ડી. હાઈસ્કૂલ વિસનગરના તાત્કાલિન આચાર્યશ્રી તા.૧૨/૭/૨૦૧૬ ની મુદતે હાજર રહેલ, તેઓએ આ બાબતે જિલ્લા માધ્યમિક અધિકારીઓની સાથે રહીને ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરાવશે એમ જણાવેલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (માધ્યમિક) તરફથી કોઈ પ્રતિનિધિ હાજર નહી રહેલ જેથી તા. ૨૬/૭/૨૦૧૬ ની મુદત રાખવામાં આવેલ પરંતુ તા.૨૬/૭/૨૦૧૬ની મુદતે અરજદારના પટેલ વિનોદકુમારના પત્ની હાજર રહેલ પરંતુ જિલ્લા શિક્ષણાધિકારી (માધ્યમિક)શ્રી ની કચેરી મહેસાણા અને જી.ડી.હાઈસ્કૂલ, વિસનગર તરફ તેમના કોઈ પ્રતિનિધિ હાજર રહેલ નથી.

૫. વિકલાંગ (સમાન તકો - અધિકારોનું રક્ષણ અને પુર્ણ ભાગીદારી) ધારો -૧૯૯૫ ની કલમ-૪૭ માં નીચે મુજબ જોગવાઈ કરવામાં આવેલ છે:

(૧) કોઈ પણ કર્મચારી પોતાના સેવાકાળ દરમ્યાન વિકલાંગ થાય તો કોઈ પણ એકમ તે કર્મચારીને તેની પાયરી નીચે ઉતારી શકાશે નહીં કે દૂર કરી શકાશે નહીં. કર્મચારી જે જગા ધરાવતો તે જગા માટે વિકલાંગતા આવ્યા પછી યોગ્ય ન હોય તે તેના એ જ પગાર ધોરણ અને સેવા લાભો સાથે અન્ય જગ્યા પર બદલી કરી શકાશે. વધુ જોગવાઈ કરવામાં આવે કે, જે તે જગ્યા પર જે તે કર્મચારીને ગોઠવવાનું શક્ય ન બને તો તેને અધિસંખ્યક જગ્યા પર ત્યાં સુધી રાખશે કે જ્યાં સુધી તેને માટે યોગ્ય જગ્યા ઉપલબ્ધ બને અથવા તે નિવૃત્તિને ઉંમરે પહોંચે બેમાંથી જે વહેલું હોય તે.

(૨) કોઈ પણ વ્યક્તિને માત્ર તેની વિકલાંગતાના આધારે બઢતીનો ઈન્કાર કરી શકશે નહીં. જોગવાઈ કરવામાં આવે છે કે જે તે સરકાર કોઈ પણ એકમમાં ચાલતા કામના પ્રકારને લક્ષમાં લઈને જાહેરનામા ધ્વારા જે તે જાહેરનામા નિર્દિષ્ટ શરતોને આધિન રહીને જો કોઈ શરતો હોય તો કોઈ પણ એકમને આ વિભાગને જોગવાઈમાંથી મુક્તિ આપી શકશે.

૬. શ્રી પટેલ વિનોદકુમાર ભીખાભાઈ જિલ્લા માધ્યમિક શિક્ષણ હસ્તકની ગ્રાન્ટ એઈડ મેળવતી જી.ડી. હાઈસ્કૂલ, વિસનગર ખાતે માધ્યમિક શિક્ષક તરીકે કામગીરી બજાવે છે. ફરજો દરમ્યાન શ્રી પટેલને વધુ વિકલાંગતા આવેલ છે. તેઓને પોતાના સેવાકાળ દરમ્યાન વિકલાંગતા વધેલ છે. જેથી ભારતીય વિકલાંગ ધારાની જોગવાઈ ૪૭ (૧) મુજબ તેઓને મદદનીશ શિક્ષક (માધ્યમિક) વિભાગના પગાર ધોરણમાં સેવા લાભ સાથે ચાલુ રાખવા રક્ષણ આપવું જરૂરી છે. જો શ્રી પટેલને માધ્યમિક શિક્ષણ વિભાગમાં પ્રસ્તુત શાળા ખાતે ચાલુ રાખવા શક્ય ન હોય તો તેઓને અધિસંખ્યક જગ્યા ઉભી કરી જ્યાં સુધી તેઓને માટે યોગ્ય જગ્યા ઉપલબ્ધ ન બને અથવા તેઓ નિવૃત્તિ ઉમરે પહોંચે એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી તેમને ચાલુ રાખવા જરૂરી છે શ્રી પટેલની રજુઆત અને ભારતીય વિકલાંગ ધારો કલમ-૪૭ (૧) (૨) જોગવાઈ અન્વયે હું નીચે મુજબ હુકમ કરું છું.

હુકમ

શ્રી પટેલ વિનોદકુમાર ભીખાભાઈ મદદનીશ શિક્ષકને જી.ડી.હાઈસ્કૂલ, વિસનગર ખાતે જાન્યુઆરી-૨૦૧૫ થી ફરજમાં હાજર ગણી તેમને વખતો વખતના પગાર ભથ્થા, મેડીકલ બીલ વગેરે ચુકવવા તથા તેમને સેવામાં ચાલુ રાખી જરૂરી રક્ષણ આપવા હુકમ કરવામાં આવે છે.

ઉક્ત હુકમ સાથે હું પ્રસ્તુત કેસનો નિકાલ કરું છું.

(સંજય નંદન)

કમિશનર

નકલ રવાના:-

(૧) પટેલ વિનોદભાઈ ભીખાભાઈ, મદદનીશ શિક્ષક, જી.ડી.હાઈસ્કૂલ, વિસનગર, તા.વિસનગર, જિ. મહેસાણા

(૨) આચાર્યશ્રી તથા સંચાલક મંડળ, જી.ડી.હાઈસ્કૂલ વિસનગર તા. વિસનગર જિ. મહેસાણા

(3) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, મહેસાણા જિ. મહેસાણા